

Commissioner of Higher Education

Contractual Vyakhyata Sahayak Recruitment for Government Colleges:2016-17
Frequently Asked Questions (FAQ)

1. શું UG તથા PGમાં એક જ વિષય હોવો જોઈએ?

હા. માન ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના SCA/9773/2015ના ચુકાદા અનુસાર સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ સમાન વિષય ધરાવતા ઉમેદવારો જ તે વિષય માટે ઉમેદવારી નોંધાવી શકશે. ઉદાહરણ
તરીકે Accountancy/Commerce વિષય માટે B.Com (એકાઉન્ટ/કોમર્સ) અને M.Com (એકાઉન્ટ/કોમર્સ) તથા Economics વિષય માટે B.A/M.A (Economics)ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

2. શું એમ.ફીલ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે ? અથવા શું અનુસ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે?

ના. યુ.જી.સીના ધારાધોરણો અનુસાર નેટ/સ્લેટ અથવા યુ.જી.સી રેગ્યુલેશન-૨૦૦૯ અનુસાર પી.એચ.ડી લાયકાત ધરાવનાર ઉમેદવાર જ અરજી કરી શકે.

3. શું બી.ઇ(ઇજનેરી) લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે?

ના. યુ.જી.સી ધારાધોરણો અનુસાર ઉમેદવાર જે તે વિદ્યાશાખામાં (વિનયન , વાણિજ્ય, વિજ્ઞાન, લો, શિક્ષણ) અનુસ્નાતક (પી.જી) ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

4. અનામત કક્ષાના ઉમેદવારે બિન-અનામત કક્ષાનો લાભ લેવા અલગથી ફોર્મ ભરવું પડે?

ના. કોઈપણ કક્ષાના ઉમેદવારે એક વિષય માટે ફક્ત એક જ ફોર્મ ભરવાનું રહે છે. જો મેરીટમાં આવતા હોય તો અનામત કક્ષાના ઉમેદવારને બિન-અનામત જગ્યાનો લાભ આપોઆપ મળવાપાત્ર છે.

5. વર્ષ ૨૦૦૯ બાદ કરેલ પી.એચ.ડી માન્ય છે?

યુ.જી.સી (Minimum Standards and Procedure for Award of Ph.D. Degree) Regulations, 2009 અનુસાર પી.એચ.ડી. કરેલ હોવું જોઈએ તથા તે મુજબનું પ્રમાણપત્ર યુનિવર્સિટીના સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવી વેરિફિકેશન સમયે રજૂ કરવાનું રહેશે.

6. શું પી.એચ.ડી થીસીસ સબમીટ કરેલ ઉમેદવાર અરજી કરી શકે?

ના. જે ઉમેદવાર પાસે અરજી કરવાના સમયે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ પી.એચ.ડી નોટિફિકેશન હશે તે જ ઉમેદવાર અરજી કરી શકશે.

7. નેટ પાસ કરેલ હોય પરંતુ પ્રમાણપત્ર મળેલ ન હોય તો શું કરવું ?

નેટ પાસ કર્યા અંગે યુ.જી.સી દ્વારા વેબસાઇટ પર પ્રકાશિત કરેલ પરીણામ ઉમેદવારે રજૂ કરવાનું રહેશે. આવા ઉમેદવારોએ સર્ટીફિકેટ નંબરની જગ્યાએ પરીક્ષાનો બેઠક ક્રમાંક દર્શાવવાનો રહેશે.

8. ગત વર્ષે કરેલ રજિસ્ટ્રેશન /ડેટાબેંક માટે કરેલ અરજી માન્ય છે?

ના, ગત વર્ષે કરેલ રજિસ્ટ્રેશન /ડેટાબેંક માટે કરેલ અરજી માન્ય નથી.

9. કેટલી કોલેજોની પસંદગી કરવી આવશ્યક છે?

ઉમેદવારના વિષય અનુસાર જે તે વિષય માટે ખાલી જગ્યાઓ ધરાવતી તમામ કોલેજો પસંદગી વિકલ્પમાં દર્શાવવામાં આવેલ છે. ઉમેદવારે તમામ કોલેજો માટે પોતાનો પસંદગી ક્રમ આપવો ફરજિયાત છે.

10. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકે?

હા. જો ઉમેદવારનો અનુસ્નાતક કક્ષાનો વિષય એક કરતાં વધુ વિષયો માટે માન્ય હોય (દા.ત કોમર્સ અને એકાઉન્ટન્સી વિષયો) તો ઉમેદવારે પ્રત્યેક વિષય માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહે છે. જે માટે ઉમેદવારે બે જુદા-જુદા ઇ-મેલ આઇ.ડી થી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

11. ISBN ધરાવતા પુસ્તકમાં કોન્ફરન્સ પેપર પ્રકાશિત થયેલ હોય તો તે માન્ય છે?

ના. ફક્ત ISSN ધરાવતા સામયિકમાં પ્રકાશિત થયેલ પેપર / સંશોધન લેખ માન્ય છે.

12. ચલણની ત્રીજી કોપીનું શું કરવું?

ઉમેદવારને જ્યારે પ્રમાણપત્ર વેરીફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ચલણની ત્રીજી ઓફીસ કોપી રજુ કરવાની રહેશે.

13. શાળાનો શિક્ષક તરીકેનો અનુભવ માન્ય ગણાશે?

ના. ફક્ત સરકારી કોલેજોમાં કરાર આધારિત વ્યાખ્યાતા સહાયક કે બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયક તરીકેનો અનુભવ જ માન્ય ગણાશે.

14. અરજી કન્ફર્મ થયેલ ક્યારે ગણાશે?

ઉમેદવારે વેબસાઇટ પર પોતાનું ઇ-મેલ આઇ.ડી આપી રજિસ્ટર થવાનું રહેશે. ઉમેદવારને ઇ-મેલ વેરીફિકેશન માટે મેલ મોકલવામાં આવશે. ઉમેદવારે પોતાના મેલમાં મળેલ લીંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. ઉમેદવારને લીંક પર ક્લિક કરવાથી પોતાનો પાસવર્ડ આપવા જણાવવામાં આવશે જે તેણે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી યાદ રાખવાનો રહેશે. પાસવર્ડ કન્ફર્મ કર્યા બાદ ફોર્મ ભરવા માટેની વિન્ડો ખુલશે. ફોર્મ સંપૂર્ણ ભરાઇ જાય ત્યાર બાદ "સેવ" કરવાથી ચલણ ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવશે. ઉમેદવારે ચલણ ડાઉનલોડ કર્યા બાદ નજીકની દેના બેંકની શાખામાં અરજી ફી જમા કરાવવાની રહેશે. બેંક દ્વારા ઉમેદવારને ચલણની બે કોપી પરત કરવામાં આવશે. ચલણ મારફત ફી ભર્યા બાદ રૂપ કલાક બાદ ઉમેદવારે વેબસાઇટ www.cheguj.com પર પોતાના ઇ-મેલ / પાસવર્ડ વડે લોગ-ઇન થઈને ચલણ ડાઉનલોડ કરેલ હતું તે વિન્ડોમાં બેંક દ્વારા ચલણમાં દર્શાવવામાં આવેલ ટ્રાન્ઝેક્શન આઇ.ડી અને તારીખ આપવાના રહેશે જેથી સિસ્ટમ દ્વારા ઉમેદવારની અરજી કન્ફર્મ કરવામાં આવેલ છે તે મુજબની સુચના પ્રદર્શિત કરવામાં આવશે. ઉક્ત સુચના પ્રદર્શિત ન થાય ત્યાં સુધી અરજી કન્ફર્મ થયેલ ગણાશે નહીં.

15. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનુસ્નાતક કક્ષાએ ૫૪% ધરાવતા ઉમેદવાર લાયક ગણાય?

ના. યુ.જી.સી ધારાધોરણો અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે અનુસ્નાતક કક્ષાએ ૫૫% હોવા જરૂરી છે.